



ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ  
 ರಾಜ್ಯ ಪೊಲೀಸ್ ಮಂಡಳಿ

ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರದ ಅಧೀನದಲ್ಲಿರುವ  
 ಪೊಲೀಸ್ ಠಾಣೆಗಳಿಗೆ

ಅರಸೀಕೆರೆ, ಮೈಸೂರು, ಕರ್ನಾಟಕ

171-M(F2)/TUL/2022/410

02 ನೇ ಸಂಖ್ಯೆ 2022

ಸರ್ಕಾರದ ಅಧೀನದಲ್ಲಿರುವ

PC-171/2022/W-L289

ಪೊಲೀಸ್ ಠಾಣೆಗಳಿಗೆ

ಅರಸೀಕೆರೆ, ಮೈಸೂರು, ಕರ್ನಾಟಕ

ಅರಸೀಕೆರೆ, ಮೈಸೂರು, ಕರ್ನಾಟಕ

Catering Services for Staffs and Arrestees at R.  
 Maduvaree Police Station

ಅಧೀನದಲ್ಲಿರುವ

ಅಧೀನದಲ್ಲಿರುವ

ಅಧೀನದಲ್ಲಿರುವ

ಅಧೀನದಲ್ಲಿರುವ

ಅಧೀನದಲ್ಲಿರುವ

መደብ 1 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ

1 ስምምነት

መደብ 1 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ

የሰነድ ስም	የሰነድ ቁጥር
<p>መደብ 1 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p>	1.0
<p>መደብ 1.1 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>የሰነድ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>የሰነድ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>af_c2100@police.gov.mv</p> <p>procurement@police.gov.mv</p>	1.1
<p>መደብ 1.2 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>የሰነድ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p>	1.2
<p>መደብ 1.3 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>የሰነድ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>2022 ዓ.ም. ጥቅምት 12 ቀን ሰዓት 09:00</p>	1.3
<p>መደብ 1.4 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>የሰነድ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>2022 ዓ.ም. ጥቅምት 10 ቀን ሰዓት 14:00</p>	1.4
<p>መደብ 1.5 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>የሰነድ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>" Bid Registration Form "</p> <p>1.1 ንዑስ-መደብ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p>	1.5
<p>መደብ 1.6 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>የሰነድ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>12:00 ሰዓት ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p>	1.6
<p>መደብ 1.7 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>የሰነድ ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p> <p>9790052 ስምምነት ላይ ለመግቢያ ማዕከል ለመስጠት ለሚያስፈልጉት ሰነድ</p>	1.7







שָׁלוֹם וְיַחְדָּוָת וְרֵוָה לְכָל אֶחָד מֵעַמְּנוּ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ

<p>אֶתְּנוּ מִלִּבְּכֶם לְעָמְנוּ וְלָאֶרֶץ וְלְיַחְדָּוָת וְרֵוָה לְכָל אֶחָד מֵעַמְּנוּ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	
<p>4.2</p> <p>תְּרַבְּרֵנוּ וְתִרְדָּנוּ וְתִחַרְדָּנוּ בְּעֵינֵינוּ וְתִלְוֵנוּ וְתִשְׁבַּחְנוּ וְתִזְכֹּרְנוּ וְתִזְכָּרְנוּ וְתִתְּנוּ לְעַמְּנוּ וְלָאֶרֶץ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p> <p>אַתְּתָּה יְיָ אֱלֹהֵינוּ וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָאָרֶץ וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הַיָּם וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הַשָּׁמַיִם וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הַיְּבוּשָׁה וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הַיַּבֵּשׁ וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָאָדָם וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הַבְּהֵמָה וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָרֶגֶט וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָעוֹלָם וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָבְרִיאָה וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הַיְּבוּשָׁה וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הַיַּבֵּשׁ וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָאָדָם וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הַבְּהֵמָה וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָרֶגֶט וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָעוֹלָם וְאַתְּתָּה יְיָ אֱלֹהֵי כָּל הָבְרִיאָה</p>	
<p>4.3</p> <p>וְתִזְכֹּרְנוּ וְתִזְכָּרְנוּ וְתִתְּנוּ לְעַמְּנוּ וְלָאֶרֶץ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	
<p><b>5.0</b></p> <p>שָׁלוֹם וְיַחְדָּוָת וְרֵוָה לְכָל אֶחָד מֵעַמְּנוּ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	
<p>5.1</p> <p>וְתִזְכֹּרְנוּ וְתִזְכָּרְנוּ וְתִתְּנוּ לְעַמְּנוּ וְלָאֶרֶץ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	
<p>5.2</p> <p>שָׁלוֹם וְיַחְדָּוָת וְרֵוָה לְכָל אֶחָד מֵעַמְּנוּ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	
<p>5.3</p> <p>וְתִזְכֹּרְנוּ וְתִזְכָּרְנוּ וְתִתְּנוּ לְעַמְּנוּ וְלָאֶרֶץ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	
<p><b>6.0</b></p> <p>שָׁלוֹם וְיַחְדָּוָת וְרֵוָה לְכָל אֶחָד מֵעַמְּנוּ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	
<p>6.1</p> <p>שָׁלוֹם וְיַחְדָּוָת וְרֵוָה לְכָל אֶחָד מֵעַמְּנוּ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	
<p>6.2</p> <p>שָׁלוֹם וְיַחְדָּוָת וְרֵוָה לְכָל אֶחָד מֵעַמְּנוּ וְלִשְׁלָמַת אֶרֶץ אֲשֶׁר אָמַרְנוּ</p>	







የደንበኞች ስነ-ምግባር ማረጋገጫ ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ

90	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	13.8
<b>የገንዘብ ስነ-ምግባር ስርዓት</b>		
14.1	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	14.1
14.2	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	14.2
14.3	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	14.3
14.4	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	14.4
14.5	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	14.5
14.6	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	14.6
14.7	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	14.7
<b>የገንዘብ ስነ-ምግባር ስርዓት</b>		
15.1	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	15.1
15.2	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	15.2
15.3	<p>የገንዘብ ስነ-ምግባር ስርዓት ለማረጋገጥ የሚያስፈልጉ የጥያቄ ሰነድ ሰነድ</p>	15.3

**ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች**

<p>PR-14 "ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ወይም ለሌሎች ሚኒስቴሮች" የሚለው ስራ</p>	
<p>15.4 ጋ ስራዎች 17.3 ላይ ያሉ ወጪ ስራዎች "የግብርና ሚኒስቴር" ስራዎች ናቸው። ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው።</p>	
<p>15.5 ጋ ስራዎች 17.1 ላይ ያሉ ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው።</p>	
<p>15.6 ጋ ስራዎች 17-09 ላይ ያሉ ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው። ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው።</p>	
<p>15.7 ጋ ስራዎች 17-09 ላይ ያሉ ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው። ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው።</p>	
<p>15.8 ጋ ስራዎች 17-09 ላይ ያሉ ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው። ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው።</p>	
<p>15.9 ጋ ስራዎች 17-09 ላይ ያሉ ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው። ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው።</p>	
<p align="center"><b>16.0 ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች</b></p>	
<p>16.1 ጋ ስራዎች 17.11 ላይ ያሉ ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው። ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች ናቸው።</p>	
<p align="center"><b>17.0 ወጪ ስራዎች ለግብርና ሚኒስቴር ወይም ለሌሎች ሚኒስቴሮች</b></p>	

17.1 17.2 17.3 17.4 17.5

<p>17.1</p> <p>10 10.33</p>	<p>17.1</p> <p>10 10.33</p>
<p>17.2</p>	<p>17.2</p>
<p>17.3</p>	<p>17.3</p>
<p>17.4</p>	<p>17.4</p>
<p>17.5</p>	<p>17.5</p>





5.2. תוכנית אב תוכנית מדיניות			
<b>6. תוכנית אב תוכנית מדיניות</b>			
<p>התוכנית תכננה לממש את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית.</p>			
#	תוכנית אב	תוכנית אב תוכנית מדיניות	תוכנית אב תוכנית מדיניות
1.			
2.			
3.			
4.			
5.			
<b>7. תוכנית אב תוכנית מדיניות</b>			
<p>התוכנית תכננה לממש את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית.</p>			
#	תוכנית אב תוכנית מדיניות	תוכנית אב תוכנית מדיניות	תוכנית אב תוכנית מדיניות
1.			
2.			
3.			
4.			
5.			
<b>8. תוכנית אב 5 תוכנית מדיניות</b>			
<p>התוכנית תכננה לממש את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית, את התוכנית המדינית.</p>			
#	תוכנית אב תוכנית מדיניות	תוכנית אב תוכנית מדיניות	תוכנית אב תוכנית מדיניות
1.			
2.			
3.			
4.			
5.			
6.			
7.			
8.			
9.			

9.9.2020 10.10.2020 10.10.2020 10.10.2020

		10
9.9.2020 10.10.2020		
<p>9.9.2020 10.10.2020 10.10.2020 10.10.2020</p>		
9.1		9.1   10.10.2020
9.1.1		10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
9.1.2		10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
9.2		10.10.2020
9.2.1		10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
9.2.2		10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
9.3		10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
	10.10.2020	10.10.2020
10		10.10.2020
10.1		10.10.2020

ש"ס לְהַחֲזִיק בְּחֻמְרוֹת הַתְּחִלָּה, ש"ס לְהַחֲזִיק בְּחֻמְרוֹת הַתְּחִלָּה

<p>אָז אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף.</p>	
<p>10.2 אָז אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף.</p>	10.2
<p>10.3 אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף.</p>	10.3
<p>11. ש"ס לְהַחֲזִיק בְּחֻמְרוֹת הַתְּחִלָּה</p>	
<p>לְהַחֲזִיק בְּחֻמְרוֹת הַתְּחִלָּה</p>	<p>ש"ס</p>
	<p>ש"ס</p>
	<p>ש"ס</p>
	<p>ש"ס</p>

ש"ס: אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף, אֵיךְ עֲלֵינוּ לְהִשָּׁרֵף וְלִישָׂרֵף.



### Form of Bid Security (Bank Guarantee)

WHEREAS, .....[name of Bidder] (hereinafter called "the Bidder") has submitted his Bid for the Project no.....issued by the Ministry of Communication, Science & Technology on .....for construction of .....[name of Contract] (hereinafter called "the Bid").

KNOW ALL PEOPLE by these presents that We ..... [name of Bank] of ..... [name of country] having our registered office at ..... (hereinafter called "the Bank") are bound unto .....[name of Purchaser] (hereinafter called "the Purchaser") in the sum of \*..... for which payment well and truly to be made to the said Purchaser, the Bank binds itself, its successors, and assigns by these presents.

SEALED with the Common Seal of the said Bank this .....day of .....20.....

THE CONDITIONS of this obligation are:

- (1) If, after Bid opening, the Bidder withdraws his Bid during the period of Bid validity specified in the Form of Bid;
- or
- (2) If the Bidder having been notified of the acceptance of his Bid by the Purchaser during the period of Bid validity:
  - (a) fails or refuses to execute the Form of Agreement in accordance with the Instructions to Bidders, if required; or
  - (b) fails or refuses to furnish the Performance Security, in accordance with the Instruction to Bidders; or
  - (c) does not accept the correction of the Bid Price pursuant to Clause 27,

\* The Bidder should insert the amount of the Guarantee in words and figures denominated in Maldivian Rufiyaa. This figure should be the same as shown in Clause 16.1 of the Instructions to Bidders.

we undertake to pay to the Purchaser up to the above amount upon receipt of his first written demand, without the Purchaser's having to substantiate his demand, provided that in his demand the Purchaser will note that the amount claimed by him is due to him owing to the occurrence of one or any of the three conditions, specifying the occurred condition or conditions.

This Guarantee will remain in force up to and including the date ..... days after the deadline for submission of bids as such deadline is stated in the Instructions to Bidders or as it may be extended by the Purchaser, notice of which extension(s) to the Bank is hereby waived. Any demand in respect of this Guarantee should reach the Bank not later than the above date.

DATE..... SIGNATURE OF THE BANK

## Form of Performance Bank Guarantee (Unconditional)

To: .....  
[name & address of Purchaser]  
.....

WHEREAS ..... [name and address of Supplier] (hereinafter called "the Supplier") has undertaken, in pursuance of Contract No. .... dated ..... to execute ..... [name of Contract and brief description of Works] (hereinafter called "the Contract");

AND WHEREAS it has been stipulated by you in the said Contract that the Supplier shall furnish you with a Bank Guarantee by a recognized bank for the sum specified therein as security for compliance with his obligations in accordance with the Contract;

AND WHEREAS we have agreed to give the Supplier such a Bank Guarantee;

NOW THEREFORE we hereby affirm that we are the Guarantor and responsible to you, on behalf of the Supplier, up to a total of \*..... [amount of Guarantee] ..... [amount in words], such sum being payable in the types and proportions of currencies in which the Contract Price is payable, and we undertake to pay you, upon your first written demand and without cavil or argument, any sum or sums within the limits of ..... [amount of Guarantee] as aforesaid without your needing to prove or to show grounds or reasons for your demand for the sum specified therein.

\*An amount is to be inserted by the Guarantor, representing the percentage of the Contract Price specified in the Contract, in Maldivian Rufiyaa.

We hereby waive the necessity of your demanding the said debt from the Supplier before presenting us with the demand.

We further agree that no change or addition to or other modification of the terms of the Contract or of the Works to be performed there under or of any of the Contract documents which may be made between you and the Supplier shall in any way release us from any liability under this Guarantee, and we hereby waive notice of any such change, addition, or modification.

This Guarantee shall be valid until the date of issue of the Defects Correction Certificate.

SIGNATURE AND SEAL OF THE GUARANTOR .....

Name of Bank .....

Address .....

Date .....

ጥያቄ - 5 (አጠቃላይ መረጃ)

1.0 የሚሙሉ የሚያስፈልጉትን ጥያቄዎች ይሙሉ።

- ❖ የሥራ ስያሜ ( ስም / ስም )
- ❖ የሥራ ስያሜ ለሚሰጠው ሰው / የሥራ ስያሜ

1.1 የሚሙሉ የሚያስፈልጉትን ጥያቄዎች ይሙሉ።

ስም	ሰው	ስያሜ
<input type="checkbox"/>	<input checked="" type="checkbox"/>	አጠቃላይ (አጠቃላይ)
<input type="checkbox"/>	<input checked="" type="checkbox"/>	ሌላ

- ❖ የሥራ ስያሜ ለሚሰጠው ሰው የሚሰጠው ስያሜ
- ❖ ስም ለሚሰጠው ሰው የሚሰጠው ስያሜ ለሚሰጠው ሰው የሚሰጠው ስያሜ
- ✓ ስያሜ ለሚሰጠው ሰው የሚሰጠው ስያሜ ለሚሰጠው ሰው የሚሰጠው ስያሜ

1.2 የሚሙሉ የሚያስፈልጉትን ጥያቄዎች ይሙሉ።

- ❖ የሥራ ስያሜ ለሚሰጠው ሰው ( ስም )
- ❖ የሥራ ስያሜ ለሚሰጠው ሰው ( ስም )
- ❖ የሥራ ስያሜ ለሚሰጠው ሰው ( ስም )
- ✓ የሥራ ስያሜ ለሚሰጠው ሰው የሚሰጠው ስያሜ ለሚሰጠው ሰው የሚሰጠው ስያሜ

1.3 מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים:

❖ בעת לאורן של מחזורי עבודה נוספים יש להשתמש.

#	המחזור	שם מחזורי עבודה נוספים
01	מחזורי עבודה נוספים	01
02	מחזורי עבודה נוספים	01

❖ מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים.

1.4 מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים:

❖ מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

❖ מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

• מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

• מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

❖ מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

❖ מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

❖ מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

❖ מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים

מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים, מחזורי עבודה נוספים



מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי

3.2 מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי (ד)

מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי

מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי

- 60 תוצרת יצרנית 100% לאור המצב הכלכלי, 10 ד"ש
- 60 תוצרת יצרנית 50% ד"ש לאור המצב הכלכלי, 05 ד"ש

#### 4 מודל (תוצרת 15)

- מבט מן המרחב | מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי
- מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי
- מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי

2- מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי

#### 5 מבט מן המרחב

מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי

#### 6 מבט מן המרחב

מבט מן המרחב, מנסה להבין את המצב הכלכלי









سورتي ۲۲ ۲۱ ۲۰ ۱۹ ۱۸ ۱۷ ۱۶ ۱۵ ۱۴ ۱۳ ۱۲ ۱۱ ۱۰ ۹ ۸ ۷ ۶ ۵ ۴ ۳ ۲ ۱

سورتي	آيتون	آيتون	آيتون	آيتون
				۲۸ رَسْمُ الْبُرُجِ (جِزَانِ)
				۲۹ نَانُورِ الْبُرُجِ (جِزَانِ)
				۳۰ اَزِي سَمَوْتِ وَجْهِ
				۳۱ جَمْرُ سَمَوْتِ وَجْهِ
				۳۲ نَانُورِ الْبُرُجِ (جِزَانِ)
				۳۳ اَلْقُرْبَانِ الْبُرُجِ
				۳۴ اَلْقُرْبَانِ الْبُرُجِ
				۳۵ رَسْمُ الْبُرُجِ (جِزَانِ)
				۳۶ رَسْمُ الْبُرُجِ
				۳۷ قُرْبَانِ الْبُرُجِ
				۳۸ قُرْبَانِ
				۳۹ نَانُورِ الْبُرُجِ (جِزَانِ)
				۴۰ قُرْبَانِ الْبُرُجِ (جِزَانِ)
				۴۱ نَانُورِ الْبُرُجِ (جِزَانِ)
				۴۲ قُرْبَانِ الْبُرُجِ (جِزَانِ)
				۴۳ رَسْمُ الْبُرُجِ
				۴۴ رَسْمُ الْبُرُجِ
				۴۵ رَسْمُ الْبُرُجِ
				۴۶ رَسْمُ الْبُرُجِ
				۴۷ قُرْبَانِ الْبُرُجِ (جِزَانِ)
				۴۸ قُرْبَانِ الْبُرُجِ (جِزَانِ)
				۴۹ جَمْرُ سَمَوْتِ وَجْهِ
				۵۰ جَمْرُ سَمَوْتِ وَجْهِ
				۵۱ اَزِي سَمَوْتِ وَجْهِ
				۵۲ رَسْمُ الْبُرُجِ (جِزَانِ)
				۵۳ رَسْمُ الْبُرُجِ (جِزَانِ)
				۵۴ رَسْمُ الْبُرُجِ (جِزَانِ)
				۵۵ رَسْمُ الْبُرُجِ
				۵۶ رَسْمُ الْبُرُجِ

የግብርና ስርዓት ማረጋገጫ ስርዓት ማረጋገጫ ስርዓት ማረጋገጫ

ግብር	ግብር	ግብር	ግብር	ግብር
				57
				58
				59
				60
				61
				62
				63
				64
				65
				66
				67
				68
				69
				70
				71
				72
				73
				74
				75
				76
				77
				78
				79
				80
				81
ግብር				

سازمان برنامه ریزی و بودجه، وزارت تعاون، کار و رفاه اجتماعی، سازمان مدیریت و برنامه ریزی

5. شرح خدمات و مشخصات فنی خدمات (در صورت لزوم)

ردیف	شرح خدمات	واحد اندازه گیری	میزان خدمات				واحد اندازه گیری	مجموع
			تعداد	واحد	واحد	واحد		
			✓			✓	300 روز.ان	سازمان
			✓		✓		01 پروژه	توسعه سیستم
						✓	01 پروژه	سازمان / توسعه سیستم
			✓		✓		100 روز	توسعه سیستم
			✓		✓		300 روز.ان	سازمان
			✓		✓		100 روز	توسعه سیستم
			✓	✓		✓	05 روز	ارزانی سیستم
<b>جمع کل</b>								





بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ



ප්‍රශ්න පත්‍රයේ පිටු 21 ක් ඇතුළත් වේ.  
දින, ප්‍රදේශය

සමස්ත ප්‍රශ්න පත්‍රයේ පිටු 21 ක් ඇතුළත් වේ. "සමස්ත ප්‍රශ්න පත්‍රයේ පිටු 21 ක් ඇතුළත් වේ" යනුවෙන් සඳහන් කර ඇත.  
දින, ප්‍රදේශය

1. දින, ප්‍රදේශය

දින, ප්‍රදේශය	කාලය:	දින, ප්‍රදේශය	දින, ප්‍රදේශය
			සමස්ත ප්‍රශ්න පත්‍රයේ පිටු 21 ක් ඇතුළත් වේ. (සමස්ත ප්‍රශ්න පත්‍රයේ පිටු 21 ක් ඇතුළත් වේ)
	දින, ප්‍රදේශය		දින, ප්‍රදේශය

2. දින, ප්‍රදේශය

		දින, ප්‍රදේශය	දින, ප්‍රදේශය
		දින, ප්‍රදේශය	දින, ප්‍රදේශය
		දින, ප්‍රදේශය	දින, ප්‍රදේශය
	දින, ප්‍රදේශය		දින, ප්‍රදේශය

3. දින, ප්‍රදේශය

		දින, ප්‍රදේශය	දින, ප්‍රදේශය
	දින, ප්‍රදේශය		දින, ප්‍රදේශය
			දින, ප්‍රදේශය





## سۆزۈڭىزنىڭ دېرىڭىنىڭ نامى، مۇسۇلمەن، سۆزۈڭىزنىڭ تۈرۈمى، ئۇنىڭسىز

تۈرۈمىڭىزنىڭ مۇسۇلمەن ئۇنىڭسىز دېرىڭىنىڭ نامى، مۇسۇلمەن نامى، ئۇنىڭسىز نامى.

نامى:	دېرىڭى:	مۇسۇلمەن:	تۈرۈمى:	مۇسۇلمەن:	نامى:
-------	---------	-----------	---------	-----------	-------

### سۆزۈڭىزنىڭ دېرىڭىنىڭ نامى

سۆزۈڭىزنىڭ دېرىڭىنىڭ نامى، مۇسۇلمەن نامى، مۇسۇلمەن نامى، ئۇنىڭسىز نامى.

مۇسۇلمەن نامى، مۇسۇلمەن نامى، مۇسۇلمەن نامى، مۇسۇلمەن نامى، مۇسۇلمەن نامى، مۇسۇلمەن نامى، مۇسۇلمەن نامى.

ክፍል 3 (አጠቃላይ)

አጠቃላይ ስርዓት ለማድረግ

አጠቃላይ ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ

1. አጠቃላይ ስርዓት



1.1 ወገን ስርዓት

ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ

1.2 ወገን ስርዓት

ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ

ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ

ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ

2. ወገን ስርዓት ለማድረግ

ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ፣ ወገን ስርዓት ለማድረግ

# ወጪዎችን ለማረጋገጥ የሚያስፈልጉ የገንዘብ ሰነዶች

### 3. የገንዘብ ሰነድ ማስገባት

ገንዘብ ሰነድ ማስገባት ማለት የገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው። ገንዘብ ሰነድ ማስገባት ለማድረግ ገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው።

### 4. የገንዘብ ሰነድ ማስገባት

ገንዘብ ሰነድ ማስገባት ማለት የገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው። ገንዘብ ሰነድ ማስገባት ለማድረግ ገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው።

ገንዘብ ሰነድ ማስገባት ማለት የገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው። ገንዘብ ሰነድ ማስገባት ለማድረግ ገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው።

የገንዘብ ሰነድ ማስገባት

### 5. የገንዘብ ሰነድ ማስገባት

ገንዘብ ሰነድ ማስገባት ማለት የገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው። ገንዘብ ሰነድ ማስገባት ለማድረግ ገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው።

ገንዘብ ሰነድ ማስገባት

ገንዘብ ሰነድ ማስገባት

ገንዘብ ሰነድ ማስገባት ማለት የገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው። ገንዘብ ሰነድ ማስገባት ለማድረግ ገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው።

### 6. የገንዘብ ሰነድ ማስገባት

ገንዘብ ሰነድ ማስገባት

ገንዘብ ሰነድ ማስገባት ማለት የገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው። ገንዘብ ሰነድ ማስገባት ለማድረግ ገንዘብ ሰነድ ለሌላ ሰነድ ለመስጠት ማስገባት ማለት ነው።

- 1- ገንዘብ ሰነድ
- 2- የገንዘብ ሰነድ
- 3- የገንዘብ ሰነድ
- 4- የገንዘብ ሰነድ



**6. ھۆججەت ۋە ھۆكۈم نەتىجىسى، ھۆكۈم قىلىش ھۆججەتلىرى، ئاھۋال ھۆججەتلىرى**

س. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى ئىشقا ئاشۇرۇش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش.

ب. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش.

ج. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش.

د. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش.

**8. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش**

ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش ۋە ئۇنىڭ ئارقىلىق تۈزۈم 2 نىڭ ئىشقا ئاشۇرۇلۇشىنى تەكشۈرۈش.

**9. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش**

- 1. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش
- 2. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش
- 3. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش (29 نەسخە)
- 4. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش
- 5. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش
- 6. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش 12 نەسخە
- 7. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش
- 8. ئۆزىنىڭ قىرغاق تۈزۈمىنى تەكشۈرۈش





14. **14. סעיף 14**

התקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של  
התקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של

14. סעיף 14

א. נא להוסיף את המילים "התקנתו של הסעיף" בסעיף 14  
30 ז' מהתקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של

ב. נא להוסיף את המילים "התקנתו של הסעיף" בסעיף 14  
התקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של

ג. נא להוסיף את המילים "התקנתו של הסעיף" בסעיף 14  
התקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של

ד. נא להוסיף את המילים "התקנתו של הסעיף" בסעיף 14  
התקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של

ה. נא להוסיף את המילים "התקנתו של הסעיף" בסעיף 14  
התקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של

ו. נא להוסיף את המילים "התקנתו של הסעיף" בסעיף 14  
התקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של

15. **15. סעיף 15**

א. נא להוסיף את המילים "התקנתו של הסעיף" בסעיף 15  
4 ז' מהתקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של

ב. נא להוסיף את המילים "התקנתו של הסעיף" בסעיף 15  
התקנתו של הסעיף, מטרתו להסדיר את התהליך של



החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

אשראי המים והסביבה. אתר הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים

החלטות הוועדה לביטחון המים, מועדון המים, מועדון המים, מועדון המים, מועדון המים



ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት

ሀ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

ለ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

19. በወጪዎች ላይ የሚደረግ የሥራ ለውጥ

በወጪዎች ላይ የሚደረግ የሥራ ለውጥ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት



20. ወጪዎች

ወጪዎች ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

ለ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

ለ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

ለ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

ለ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

ለ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

ለ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት

ለ. ወጪዎችን ለማሰብ ለማድረግ ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት ወጪዎችን ለመለየት







መደብ ፩፡ መግቢያ


ይህ መደብ ለሌሎች ስራዎች ለማግኘት የሚያስፈልገውን የሰው ሀብት ማግኘት ይቻላል።

30. ስራ ለማግኘት የሚያስፈልጉትን ሰው ሀብት

1. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።  
2. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።

31. ስራ ለማግኘት የሚያስፈልጉትን ሰው ሀብት

1. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።  
2. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።



32. ስራ ለማግኘት የሚያስፈልጉትን ሰው ሀብት

1. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።  
2. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።

33. ስራ ለማግኘት የሚያስፈልጉትን ሰው ሀብት

1. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።  
2. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።

34. ስራ ለማግኘት የሚያስፈልጉትን ሰው ሀብት

1. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።  
2. ስራ ለማግኘት የሚያስፈልጉትን የሰው ሀብት ማግኘት ይቻላል።











سۆزۈڭىزنىڭ دېڭىزىنىڭ ئىسمى، سۆزۈڭىزنىڭ تەركىبى، ئۆزۈڭىزنىڭ ئىسمى

نومۇرى	ئىسمى	تەركىبى	ئۆزۈڭىزنىڭ ئىسمى	نومۇرى
			ئۆزۈڭىزنىڭ ئىسمى	03
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	04
			ئۆزۈڭىزنىڭ ئىسمى	05
			ئۆزۈڭىزنىڭ ئىسمى	06
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	07
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	08
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	09
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	10
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	11
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	12
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	13
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	14
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	15
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	16
			ئۆزۈڭىزنىڭ ئىسمى	17
			ئۆزۈڭىزنىڭ ئىسمى	18
			ئۆزۈڭىزنىڭ ئىسمى	19
			ئۆزۈڭىزنىڭ ئىسمى	20
			ئۆزۈڭىزنىڭ ئىسمى (ئۆزۈڭىز)	21

دەرىجە  
سۆزۈڭىز

سۆزۈڭىزنىڭ دېڭىزىنىڭ نامىنى، سۆزۈڭىزنىڭ تۈرۈمى، ئۆزۈڭىزنىڭ تۈرۈمى

نومۇرى	تۈرۈمى	نومۇرى	تۈرۈمى	نومۇرى	تۈرۈمى
22				تۈرۈمى (تۈرۈم)	
23				تۈرۈم (تۈرۈم)	
24				تۈرۈم (تۈرۈم)	
25				تۈرۈم (تۈرۈم)	
26				تۈرۈم (تۈرۈم)	
27				تۈرۈم (تۈرۈم)	
28				تۈرۈم (تۈرۈم)	
29				تۈرۈم (تۈرۈم)	
30				تۈرۈم (تۈرۈم)	
31				تۈرۈم (تۈرۈم)	
32				تۈرۈم (تۈرۈم)	
33				تۈرۈم (تۈرۈم)	
34				تۈرۈم (تۈرۈم)	
35				تۈرۈم (تۈرۈم)	
36				تۈرۈم (تۈرۈم)	
37				تۈرۈم (تۈرۈم)	
38				تۈرۈم (تۈرۈم)	
39				تۈرۈم (تۈرۈم)	
40				تۈرۈم (تۈرۈم)	

دەرىجە

سۆزۈن ئۆزگەرتىش، سۆزۈن ئۆزگەرتىش، سۆزۈن ئۆزگەرتىش، سۆزۈن ئۆزگەرتىش

سۆزۈن ئۆزگەرتىش	سۆزۈن ئۆزگەرتىش	سۆزۈن ئۆزگەرتىش	سۆزۈن ئۆزگەرتىش	سۆزۈن ئۆزگەرتىش
			سۆزۈن ئۆزگەرتىش (سۆزۈن ئۆزگەرتىش)	41
			سۆزۈن ئۆزگەرتىش (سۆزۈن ئۆزگەرتىش)	42
			سۆزۈن ئۆزگەرتىش	43
			سۆزۈن ئۆزگەرتىش	44
			سۆزۈن ئۆزگەرتىش	45
			سۆزۈن ئۆزگەرتىش	46
			سۆزۈن ئۆزگەرتىش (سۆزۈن ئۆزگەرتىش)	47
			سۆزۈن ئۆزگەرتىش (سۆزۈن ئۆزگەرتىش)	48
			سۆزۈن ئۆزگەرتىش	49
			سۆزۈن ئۆزگەرتىش	50
			سۆزۈن ئۆزگەرتىش	51
			سۆزۈن ئۆزگەرتىش (سۆزۈن ئۆزگەرتىش)	52
			سۆزۈن ئۆزگەرتىش (سۆزۈن ئۆزگەرتىش)	53
			سۆزۈن ئۆزگەرتىش (سۆزۈن ئۆزگەرتىش)	54
			سۆزۈن ئۆزگەرتىش	55
			سۆزۈن ئۆزگەرتىش	56
			سۆزۈن ئۆزگەرتىش	57
			سۆزۈن ئۆزگەرتىش (سۆزۈن ئۆزگەرتىش)	58
			سۆزۈن ئۆزگەرتىش	59

سۆزۈن ئۆزگەرتىش

دودونو دودونو دودونو دودونو دودونو دودونو دودونو دودونو دودونو دودونو

نمبر	نمبر	نمبر	نمبر	نمبر
				60
				61
				62
				63
				64
				65
				66
				67
				68
				69
				70
				71
				72
				73
				74
				75
				76
				77
				78

دودونو دودونو دودونو دودونو دودونو دودونو دودونو دودونو دودونو دودونو

**መረጃና ልማት ምዕራፍ ማህተም**

አድርጎት	ምዕራፍ	ክፍል	ስም
79			ህይወት - ማህተም (5 ገጽ)
80			ህይወት - ማህተም (5 ገጽ)
81			ህይወት - ማህተም (5 ገጽ)
<b>0.00</b>	<b>ጠቅላላ</b>		

**5. የህይወት ማህተም ስልጠና (የህይወት ማህተም)**

ምዕራፍ	አድርጎት	ክፍል	ስልጠና			የሚሰጠው
			ሰዓት	ደንበኞች	የተጠቃሚዎች	
			<input checked="" type="checkbox"/>			300 ሰዓት
			<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>	01 የሰዓት
					<input checked="" type="checkbox"/>	01 የሰዓት
			<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>	100 ሰዓት
			<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>	300 ሰዓት
			<input checked="" type="checkbox"/>		<input checked="" type="checkbox"/>	100 ሰዓት
			<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>	<input checked="" type="checkbox"/>	05 ሰዓት
<b>0.00</b>	<b>ጠቅላላ</b>					

**ይገባል 2**

**ምዕራፍ ስልጠና ስልጠና ስልጠና**  
(5 ሰዓት ዕለት)



## ጊዜ ሰንጠረዥ

2.1. ጊዜ ሰንጠረዥ ለማረጋገጥና ለማረጋገጥ ማህበራዊ ግንኙነት ማረጋገጥና ማጠናከሩን ያረጋግጣል

ሰ. ጊዜ ሰንጠረዥ

ጊዜ ሰንጠረዥ						
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
<p>(ጊዜ ሰንጠረዥ ለማረጋገጥና ለማረጋገጥ ማህበራዊ ግንኙነት ማረጋገጥና ማጠናከሩን ያረጋግጣል)</p> <p>(ጊዜ ሰንጠረዥ ለማረጋገጥና ለማረጋገጥ ማህበራዊ ግንኙነት ማረጋገጥና ማጠናከሩን ያረጋግጣል)</p> <p>(ጊዜ ሰንጠረዥ ለማረጋገጥና ለማረጋገጥ ማህበራዊ ግንኙነት ማረጋገጥና ማጠናከሩን ያረጋግጣል)</p>						
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ

- \* ጊዜ ሰንጠረዥ ለማረጋገጥና ለማረጋገጥ ማህበራዊ ግንኙነት ማረጋገጥና ማጠናከሩን ያረጋግጣል
- \* ጊዜ ሰንጠረዥ ለማረጋገጥና ለማረጋገጥ ማህበራዊ ግንኙነት ማረጋገጥና ማጠናከሩን ያረጋግጣል
- \* ጊዜ ሰንጠረዥ ለማረጋገጥና ለማረጋገጥ ማህበራዊ ግንኙነት ማረጋገጥና ማጠናከሩን ያረጋግጣል
- \* ጊዜ ሰንጠረዥ ለማረጋገጥና ለማረጋገጥ ማህበራዊ ግንኙነት ማረጋገጥና ማጠናከሩን ያረጋግጣል

ሰ. ጊዜ ሰንጠረዥ

ጊዜ ሰንጠረዥ						
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ
ጊዜ	የሰዓት	ቀን	የሰዓት	ቀን	የሰዓት	ጊዜ

© 2021 ...  
 ...

...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...
...	...	...	...	...	...	...

- \* ...
- \* ...
- \* ...

...

...						
...	...	...	...	...	...	...
...						



















### ቅጽ 3


የሥራ ሰዓት

(14 መስመሮች)

### የሥራ ሰዓት

### 3.1 ሥራ ሰዓት

- የሥራ ሰዓት ለሰው ሰው ለማስፈሰፍ ማስፈሰፍ.





بۆلۈم 4

بۆلۈم 4 نىڭ قۇرۇلۇشى ۋە تەركىبى ھۆججەت ۱۱۱۱۱۱۱۱

(15 نۆمۈر ئىشەنچ نامى (بۇ نامدا))



1. لايىھى / نامى		1
1. لايىھى		1.1
ھۆججەت 11111	ھۆججەت 22222	
ھۆججەت 33333   ھۆججەت 44444	ھۆججەت 55555   ھۆججەت 66666	
2. لايىھى		1.2
ھۆججەت 77777	ھۆججەت 88888	
ھۆججەت 99999   ھۆججەت 101010	ھۆججەت 111111   ھۆججەت 121212	
2. قۇرۇلۇش		2
1. قۇرۇلۇش		2.1
ھۆججەت 131313	ھۆججەت 141414	
ھۆججەت 151515   ھۆججەت 161616	ھۆججەت 171717   ھۆججەت 181818	
2. قۇرۇلۇش		2.2
ھۆججەت 191919	ھۆججەت 202020	
ھۆججەت 212121   ھۆججەت 222222	ھۆججەت 232323   ھۆججەت 242424	
3. ئىشەنچ نامى		3
ھۆججەت 252525	ھۆججەت 262626	
ھۆججەت 272727   ھۆججەت 282828	ھۆججەت 292929   ھۆججەت 303030	

*(Handwritten signature and stamp)*

ይጠቀሙ 5

ለመረጃ ለማግኘት ይጠቀሙ፣ የሰነድ ደንብ ለመግቢያ፣ ለመረጃ ለማግኘት

(34 ዓመት ደንብ ይጠቀሙ)

ለመረጃ ለማግኘት ይጠቀሙ፣ የሰነድ ደንብ ለመግቢያ፣ ለመረጃ ለማግኘት (በደንብ ለመግቢያ)		1
የሰነድ	የሰነድ	1.1
የሰነድ ለመግቢያ	የሰነድ ለመግቢያ	1.2
የሰነድ	የሰነድ	1.3
	የሰነድ ለመግቢያ	1.4
የሰነድ ለመግቢያ	የሰነድ ለመግቢያ	1.5
	የሰነድ ለመግቢያ	1.6
የሰነድ ለመግቢያ	የሰነድ ለመግቢያ	1.7
የሰነድ ለመግቢያ	የሰነድ ለመግቢያ	1.8

6 ވަނަ ބައި

ސަރުކާރުގެ ގެޒެޓްގައި ބަޔާންކުރި ގަވާއިދުގެ ދަށުން

(34 ވަނަ ބައި 34 ވަނަ ބައި)

1		ސަރުކާރުގެ ގެޒެޓްގައި ބަޔާންކުރި ގަވާއިދުގެ ދަށުން (ނިންމާލުމުގެ ގޮތުން)
1.1	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
1.2	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
1.3	ސަރުކާރުގެ ގެޒެޓް / ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް / ސަރުކާރުގެ ގެޒެޓް
1.4	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
1.5	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
1.6	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
1.7	ސަރުކާރުގެ ގެޒެޓް	@police.gov.mv
2		ސަރުކާރުގެ ގެޒެޓްގައި ބަޔާންކުރި ގަވާއިދުގެ ދަށުން (ނިންމާލުމުގެ ގޮތުން)
2.1	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
2.2	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
2.3	ސަރުކާރުގެ ގެޒެޓް / ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް / ސަރުކާރުގެ ގެޒެޓް
2.4	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
2.5	3322112, 9790052	3322112, 9790052
2.6	ސަރުކާރުގެ ގެޒެޓް	ސަރުކާރުގެ ގެޒެޓް
2.7	ސަރުކާރުގެ ގެޒެޓް	@police.gov.mv procurement@police.gov.mv

سَوَدَدِيَّ دَرَدَدِيَّ نَمَرَدِيَّ، سَوَسَرِيَّ، سَوَدَدِيَّ جَرَدَدِيَّ، اَرَدَدِيَّ


### 1 جَرَدَدِيَّ 7

اَرَدَدِيَّ جَرَدَدِيَّ، نَ جَرَدَدِيَّ اَرَدَدِيَّ سَوَدَدِيَّ

(12) سَوَدَدِيَّ (اَرَدَدِيَّ)

1- اَرَدَدِيَّ

2- نَ جَرَدَدِيَّ اَرَدَدِيَّ







سولہ روزہ کارڈ، سولہ روزہ کارڈ، سولہ روزہ کارڈ، سولہ روزہ کارڈ، سولہ روزہ کارڈ

P.O Number (Staff):

سولہ روزہ کارڈ

O Number (Arrest):

سولہ روزہ کارڈ

سولہ روزہ کارڈ، سولہ روزہ کارڈ، سولہ روزہ کارڈ، سولہ روزہ کارڈ، سولہ روزہ کارڈ

31		31		01		31	
سولہ روزہ کارڈ		سولہ روزہ کارڈ		سولہ روزہ کارڈ		سولہ روزہ کارڈ	
سولہ روزہ کارڈ	سولہ روزہ کارڈ	سولہ روزہ کارڈ		سولہ روزہ کارڈ		سولہ روزہ کارڈ	سولہ روزہ کارڈ
		سولہ روزہ کارڈ	سولہ روزہ کارڈ	سولہ روزہ کارڈ	سولہ روزہ کارڈ		
						01	سولہ روزہ کارڈ
						02	سولہ روزہ کارڈ
						03	سولہ روزہ کارڈ
						04	سولہ روزہ کارڈ
						05	سولہ روزہ کارڈ
						06	سولہ روزہ کارڈ
						07	سولہ روزہ کارڈ
						08	سولہ روزہ کارڈ
						09	سولہ روزہ کارڈ
						10	سولہ روزہ کارڈ
						11	سولہ روزہ کارڈ
						12	سولہ روزہ کارڈ
						13	سولہ روزہ کارڈ
						14	سولہ روزہ کارڈ
						15	سولہ روزہ کارڈ
						16	سولہ روزہ کارڈ
						17	سولہ روزہ کارڈ
						18	سولہ روزہ کارڈ
						19	سولہ روزہ کارڈ
						20	سولہ روزہ کارڈ
						21	سولہ روزہ کارڈ
						22	سولہ روزہ کارڈ
						23	سولہ روزہ کارڈ
						24	سولہ روزہ کارڈ
						25	سولہ روزہ کارڈ
						26	سولہ روزہ کارڈ
						27	سولہ روزہ کارڈ
						28	سولہ روزہ کارڈ
						29	سولہ روزہ کارڈ
						30	سولہ روزہ کارڈ
						31	سولہ روزہ کارڈ

2 ለገንዘብ ማጠቃለያ

ገንዘብ ማጠቃለያ ለገንዘብ ማጠቃለያ ማድረግ

(13ኛው ገንዘብ ማጠቃለያ)

2- ለገንዘብ ማጠቃለያ ማድረግ (ገንዘብ ማጠቃለያ)

ገንዘብ ማጠቃለያ ለገንዘብ ማጠቃለያ ማድረግ - 2020										
02 ለገንዘብ ማጠቃለያ					01 ለገንዘብ ማጠቃለያ					
ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ	ገንዘብ
1										
2										
3										
4										
5										
6										
7										
8										
9										
10										
11										
12										
13										
14										
15										
16										
17										
18										
19										
20										

ገንዘብ ማጠቃለያ

ገንዘብ ማጠቃለያ ለገንዘብ ማጠቃለያ ማድረግ	ገንዘብ ማጠቃለያ ለገንዘብ ማጠቃለያ ማድረግ	ገንዘብ ማጠቃለያ ለገንዘብ ማጠቃለያ ማድረግ	ገንዘብ ማጠቃለያ ለገንዘብ ማጠቃለያ ማድረግ